



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૨૯/૯/૨૦૧૪ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૫૩/૧૪

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૪ કેસ કરી ૨૯ વ્યક્તિઓને ઝડપી, ૧૨૫ લીટર દેશી દારૂ, ૩૬ બોટલ ઇચ્છીશ દારૂ, ૭૬ ક્વોટર ઇચ્છીશ દારૂ અને ૪૨ બિયર ટીન કબ્જે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૧ કેસ કરી ૧ વ્યક્તિને ઝડપી રૂપિયા ૧૧૯૦/- અને જુગારના સાધનો કબ્જે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૫૪/૧૪

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ખુનની કોશીષ :-

સમાચાર યાદી નં.૨૪૫૫/૧૪

સરખેજ : સબરજાનબીબી અબ્દુલગની શેખ (ઉ.વ.૫૦)(રહે.બાબુભાઈના ઘરની ચાલી, સિપાઈવાસ, સરખેજ) એ તા.૨૭/૯/૧૪ નારોજ વી.એસ.હોસ્પિટલ ખાતે સરખેજ પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૯/૧૪ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક પડોશમાં રહેતાં આરોપણ બહેન (૧) સલમાબહેન અને (૨) મોનીકાબહેન નાઓએ ભેગામળી સબરજાનબીબીના ઘરે આવી અગાઉ “તમારા છોકરા અમારા છોકરાઓ સાથે કેમ ઝઘડા કરે છે” તેમ કહી તા.૨૬/૯/૧૪ નારોજ થયેલ ઝઘડાની અદાવત રાખી પ્રાયમસમાંથી કેરોસીન કાઢી સબરજાનબીબી ઉપર છાંટી દઈ, જાનથી મારી નાંખવાના ઇરાદે સબરજાનબીબીને સળગાવી દઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.એસ.પુનડીયા ચલાવે છે.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૪૫૬/૧૪

આનંદનગર : નિકીતાબહેન હર્ષદકુમાર ઠક્કર (રહે.ઇશાન -૨, સેલ્બી હોસ્પિટલ પાછળ, સેટેલાઈટ) એ તા.૨૮/૯/૧૪ નારોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૯/૧૪ બપોરનાં ૧૨/૩૦ થી ૧/૪૫ વાગ્યા દરમ્યાન નિકીતાબહેનનાં ઘરે ત્રણ કિન્નરો (૩૦ થી ૩૫ વર્ષના આશરાના) આવ્યા હતા. જે કિન્નરોએ નિકીતાબહેનને વિશ્વાસમાં લઈ વિધી કરવાના બહાને નિકીતાબહેન પાસેથી સોનાની બે બુટ્ટી, સોનાની વિટી તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૯૭,૩૦૦/- ની મતા મેળવી લઈ નિકીતાબહેન સાથે છેતરપીંડી કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.ડી.સોલંકી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૪૫૭/૧૪

વટવા : સંજયભાઈ બાલારામ ઉપાધ્યાય (ઉ.વ.૨૧)(૨હે.ચાર માળીયા, સદભાવના નગર, વટવા) એ કોઈ અગમ્ય કારણસર તા.૨૮/૯/૧૪ બપોરનાં ૬/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો. શ્રી ખોડાભાઈ રામાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.